

રાજકોટ મહાનગરપાલિકા

ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧

--: અખબારી યાદી :-

શહેરમાં ૩૦ સ્થળોએ ઓટોમેટિક ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ મુકવા આયોજન : મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ

તા.૧૧-૧૨-૨૦૧૯

રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લી. (RSCDL) ના સેવોતમ પ્રોજેક્ટ હેઠળ રાજકોટ શહેરમાં અલગ-અલગ મુખ્ય સર્કલો પર કુલ ૧૯ નવા ટ્રાફિક સિગ્નલ તથા હયાત જુના ટ્રાફિક સિગ્નલ દુર કરી તેની જગ્યાએ ૧૧ નવા એમ કુલ ૩૦ નંગ એડપ્ટીવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ (ATCS) સ્થાપિત કરવામાં આવશે જેનું અંદાજિત કુલ રૂ. ૧૧,૭૪,૦૦,૦૦૦/- ના ખર્ચ થનાર છે, તેમ મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલએ જણાવ્યું હતું.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, ભારત દેશના અમુક રાજ્યના મુખ્ય શહેરોએ અપનાવેલ નવી ટેકનોલોજી મુજબના ATCS ટ્રાફિક સિગ્નલ કે જે અત્યારની સૌથી લેટેસ્ટ આધુનિક ટેકનોલોજી હોય, જેનું સંપૂર્ણ કંટ્રોલ એન્ડ મોનીટરીંગ ICC ખાતે નવા બનનાર ડેટા સેન્ટરમાંથી થશે.

આ ટેકનોલોજી અંતર્ગત ટ્રાફિક સિગ્નલ પર વાહનોને ડિટેક્ટ કરીને ટ્રાફિક સિગ્નલના સમયને વધારી અને ઘટાડી શકે છે આમ આ ટેકનોલોજીથી ટ્રાફિક જંકશન પર થતા સમયના વ્યયને ઘટાડી શકાય છે.

જેમ કે શહેરના કોઈ પણ સર્કલ કે ચોક પર આ સિસ્ટમ લગાવવાથી જે તરફના રસ્તા પર વધુ ટ્રાફિક છે તે તરફના રસ્તા પરના વાહનોને પસાર થવા માટે વધુ સમય

મળશે અને જે તરફના રસ્તા પર ઓછો ટ્રાફિક છે તે તરફના રસ્તાને ટ્રાફિક પ્રમાણે પસાર થવા માટે સમય મળશે. જેનાથી સમયનો પણ બચાવ થશે અને વાહનોને પસાર થવા માટે પુરતો સમય પણ મળી રહેશે.

રાજકોટ શહેરમાં માધાપર ચોકડી, ગ્રીનલેન્ડ ચોક, જીલ્લા પંચાયત ચોક, મક્કમ ચોક, નાણાવટી ચોક, ઇન્દીરા ચોક, લવલી ગેસ્ટ હાઉસ પાસે, ભૂતખાન ચોક, લીમડા ચોક, એસ.બી.એસ. ચોક-જવાહર રોડ, કોર્પોરેશન ચોક, બીગ બજાર સર્કલ, આજીડેમ ચોક, રૈયા ચોક, કોસ્મો ચોક-નવા રીંગ રોડ, કે.કે.વી. ચોક, પુનીત નગર ચોક, મવડી ચોક, રૈયા ટેલીફોન ચોક, જડુશ ચોક, રાજનગર ચોક, નાનામવા ચોક, રામદેવપીર ચોક, હનુમાન મઢી ચોક, ત્રિકોણ બાગ ચોક, ઢેબર ચોક, કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ ચોક, નાગરિક બેંક ચોક, જામટાવર ચોક વિગેરે સ્થળો મળીને કુલ ૨૯ સ્થળો પર ટ્રાફિક સિગ્નલ લોકેશન લગાવવામાં આવેલ છે, અને હાલ ૩૦ મુ સિગ્નલ લગાવવા માટે સ્થળ નક્કી થશે.

(જન સંપર્ક અધિકારી)

રાજકોટ મહાનગરપાલિકા